

# દેશની કોઇ પણ લાઇબ્રેરીમાં યુ.જી.સી.ના નોર્મ્સ પ્રમાણે લાઇબ્રેરીયનની નિમણૂક કરાઇ નથી

સમગ્ર દેશની લાઇબ્રેરીમાં યુ.જી.સી.ના નોર્મ્સ પ્રમાણે એકય લાઇબ્રેરીયન્સની ભરતી આજ સુધી કરવામાં આવી નથી. જેના લીધે લાઇબ્રેરીનું ડેવલપમેન્ટ જે સ્તરે થવું જોઈએ તે થઈ શકતું નથી. આજે સમગ્ર વિશ્વમાં ડિજિટાઇઝેશન થઈ ગયું હોવા છતાં સ્ટુડન્ટ્સ ઈ લાઇબ્રેરી કરતાં લાઇબ્રેરીમાં બેસી રીડિંગ કરવાનું વધુ પસંદ કરે છે. એટલે લાઇબ્રેરીમાં ફિઝિકલ સ્પેસ વધારવું જોઈએ જે આપણા દેશમાં થતું નથી.

આ બાબત પર ફોકસ કરવું જોઈએ, ત્રીજું કે લાઇબ્રેરીનું સ્ટ્રચર, સ્ટુડન્ટ્સને ઉપયોગી થઈ શકે તેવા બુક્સની વ્યવસ્થા માટે યોગ્ય માત્રામાં ફંડની વ્યવસ્થા કરવી, ઉપરોક્ત તમામ બાબતોની આજે દેશની દરેક લાઇબ્રેરીમાં અવગણના કરવામાં આવે છે તેમ આઈ.આઈ.એમ. અમદાવાદ ખાતે આજથી શરૂ થયેલ બે દિવસીય ગ્લોબલ કોન્ફરન્સ ઓન ઈમર્જિંગ ટ્રેન્ડ્સ ઈન બિઝનેસ લાઇબ્રેરીમાં લેકચર આપતા આઈ.આઈ.એમ. અમદાવાદની વિક્રમ સારાભાઈ લાઇબ્રેરીના લાયબ્રેરીયન ડો. એચ.અનિલ કુમારે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બે દિવસીય કોન્ફરન્સમાં આંતરપ્રિન્સિપાલશીપ, ઈનોવેશન, અને લીડરશિપ ઉપર દેશ વિદેશથી આવેલા વક્તાઓ પોત પોતાના વિચારો રજૂ કરશે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલ



મીશીગનની રોસ સ્કૂલ ઓફ બિઝનેસ યુનિવર્સિટીના લાઇબ્રેરીયન કોરી સીમને સેવ ધ ટાઈમ ઓફ ધ રિડર

ઉપર વાત કરતાં જણાવ્યું હતું કે અમારે ત્યાં બિઝનેસ લાઇબ્રેરી છે. ત્યાં બિઝનેસ લાઇબ્રેરીને અમે પ્રેત્સાહન આપીએ છીએ જેથી અમારે ત્યાં માત્ર ૨૦૦ બુક્સ જેને

હાર્ડ કોપી કહી શકાય તે અવેલેબલ છે બાકી ત્યાં મોટા ભાગે રિસર્ચ બેઝડ કામ થતું હોવાથી ઈ લાઇબ્રેરીને પ્રમોટ કરવા ૭૦ હજાર કરતાં વધુ ઈલેક્ટ્રોનિક રિસોર્સ અવેલેબલ છે જે ટ્રેન્ડ્સ, ઈકોનોમી અને બિઝનેસના બુક્સને પ્રોત્સાહન આપે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લાઇબ્રેરી થકી કમ્યુનિટીનું ઉત્થાન થતું હોય છે તેથી તેમાં વધુને વધુ બુક્સ અને કમ્યુનિટીને ઉપયોગી થાય તેવા બુક્સ વસાવવા જોઈએ. તેમજ ગવર્નમેન્ટે પણ વહેલી તકે પરમનન્ટ લાઇબ્રેરીયન રિક્રુટ કરવા જોઈએ જે સામજ કે કોલજોના હિતમાં હિતાવહ રહે.